

Shalby/SE/2024-25/99

February 4, 2025

The Listing Department

National Stock Exchange of India Ltd

Mumbai 400 051.

Scrip Code : SHALBY

Through: https://neaps.nseindia.com/NEWLISTINGCORP/

Corporate Service Department **BSE Limited** Mumbai 400 001.

Scrip Code: 540797

Through: http://listing.bseindia.com

Sub: Submission of Newspaper publication of Unaudited Financial Results (Standalone and Consolidated) for quarter and nine months ended December 31, 2024 - Regulation 30 & 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, please find enclosed herewith the copies of advertisement published on February 4, 2025 in Financial Express (English and Gujarati) for Unaudited Financial Results (Standalone and Consolidated) for the quarter and nine months ended December 31, 2024, as approved by the Board of Directors at its meeting held on February 3, 2025.

We request to take the same on your records.

Thanking you,

Yours sincerely For **Shalby Limited**

Tushar Shah
AVP & Company Secretary

Mem. No: FCS-7216

Encl.: as above

SHALBY LIMITED

Regd. Office: Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad - 380 015, Gujarat, India. Tel: 079 40203000 | Fax: 079 40203109 | info.sg@shalby.org | www.shalby.org CIN: L85110GJ2004PLC044667

SMFG INDIA CREDIT COMPANY LIMITED (Formerly Fullerton India Credit Company Limited) **CORRIGENDUM NOTICE**

In The Mandate Dated 02/02/2025 In The Context Of Smfg India Credit Company Limited (Formerly Fullerton India Credit Company Limited) Issued Sale Notice Published At Page No. 21 Of Financial Express (English) And Page No. 3 Of Jandesh (Gujarati) Where The Name Of Borrowers Is Mentioned As 1) Jignesh Manharlal Patel 2) Bhartiben Jigneshbhai Chovativa Instead Of 1. Jignesh Shamiibhai Tilala 2. Vijvaben Shamiibhai Tilala Place: Rajkot Date: 04.02.2025 SD/-, Authorised Officer, SMFG India Credit Company Limited (Formerly Fullerton India Credit Co. Ltd.)

SHALBY LIMITED

Regd. Office: Shalby Multi-Specialty Hospitals, Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad 380015, Gujarat • Tel: 079 40203000 Fax: 079 40203109 E-mail: companysecretary@shalby.in website: www.shalby.org CIN: L85110GJ2004PLC044667 SHALBY

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2024

(₹in million, except per share data)

◆Passion → Compassion → Innovation →

	Particulars		Standalone		Consolidated			
Sr.		Quarter ended		Nine Months ended	Quarter ended		Nine Months	
No.		31-12-2024	31-12-2023	31-12-2024	31-12-2024	31-12-2023	ended 31-12-2024	
		(Una	udited)	(Unaudited)	(Una	udited)	(Unaudited)	
1	Total income from operations	2,206.40	1,951.53	6,656.26	2,756.33	2,160.47	8,220.62	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	357.70	384.79	1,100.62	123.50	308.11	564.67	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	357.70	384.79	1100.62	123.50	308.11	564.67	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	208.58	247.24	688.35	(29.93)	190.64	141.08	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	209.16	247.88	690.08	(57.45)	190.65	111.33	
6	Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- each) (Net of Treasury Shares)	1,074.87	1,073.53	1,074.87	1,074.87	1,073.53	1,074.87	
7	Reserves (excluding Revaluation Reserve)	8		*	*	⊃e:	38	
8	Earnings Per Share (Face Value of ₹ 10/- each) (not annualized)							
	(I) Basic EPS	1.94	2.30	6.41	(0.28)	1.78	1.31	
	(II) Diluted EPS	1.94	2.30	6.41	(0.28)	1.78	1.31	

Notes:

 The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and Nine Months ended December 31, 2024, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone and Consolidated Financial Results for the guarter and Nine Months ended December 31, 2024 are available on the websites of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and on the Company's website www.shalby.org.

Place: Ahmedabad Date: February 3, 2025



For and on behalf of Board of Directors Dr. Vikram Shah Chairman and Managing Director DIN: 00011653

बैंक ऑफ इंडिया Bank of India

ASSET RECOVERY MANAGEMENT BRANCH

Bank of India Building, First Floor, 25, S. V. Road, Andheri (W), Near Andheri West Railway Station, Mumbai - 400 058. Tel No. - 25210406 / 07, Email: asset.mnz@bankofindia.co.in

E-AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002 read with proviso to Rule8(6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the following Borrower(s) and Guarantor(s) that the below described immovable property

mortgaged/charged to Bank of India (Secured Creditor), the constructive/physical possession of which has been taken by the Authorized Officers of Bank of India. will be held on "as is Where is" "as is what is", and "whatever there is", for recovery of respective dues as detailed here under against the secured assets mortgaged/charged to Bank of India from respective borrowers and guarantors. The reserve price and earnest money deposit is shown there against each secured asset. The sale will be done by the undersigned through E-Auction platform provided hereunder.

E-AUCTION SALE NOTICE UNDER SARFAESI ACT2002 CUM NOTICE TO BORROWER / GUARANTOR

(Rs. In Lakh) (E-Auction Date: 10.03.2025)

Sr. No.	Names of the Account / Borrower/ Guarantor	Description of the Properties	Price / EMD	Minimum Bid Increment (In Lakhs)	O/s. Dues (Excluding Int. Penal Int. & Exp.) In Rs. Lakh	Cersal Security Interest/ Asset Id	Date/ Time of on site inspection of property	Contact No.
1.	M/s. Vibrant Fab Pvt. Ltd. Mr. Nirmal Manubhal Desai Mr. Hitesh Manubhai Desai	Flat No. E-5, 2nd Floor, E- Wing, ABHISHEK PARK, Near Someswar Enclave, Udhana-Magdalla Road, Surat, Gujarat-395007 owned by Mr. Hitesh Manubhai Desai Build up Area – 1730.00 Sq. Ft. (Physical Possession with Bank)	1	1.00	1257.47	200009641711	11.02.2025 11:30 AM To 1.30 PM	8777039798

Terms and Conditions of the E-auction are as under:

E-Auction is being held on "AS IS WHERE IS" basis, "AS IS WHAT IS BASIS" and "WHATEVER THERE IS BASIS" and will be conducted "On Line". The auction sale will be "online E-auction / Bidding through website - URL: https://BAANKNET.com on 10.03.2025 between 11:00 AM and 05:00 PM with unlimited extensions of 10 minutes each. E-auction bid form Declaration, General Terms and Conditions of online auction sale are available in websiteshttps://www..bankofindia.co.in Bidder may visit URL: https://BAANKNET.com , where "Guidelines" for Bidders are available with educational videos. Bidders have to complete following

formalities well in advance:-

 Step 1: Bidder / Purchaser Registration; Bidder to Register on e-Auction portal URL: https://BAANKNET.com.using.his.mobile.no. and E-mail ID. (PDF(Buyer Manual) describing the step by step process for registration is available for download in the home page under Help option at the bottom of the page.) Step 2: KYC Verification: Bidder to upload requisite KYC documents. KYC documents shall be verified by e-auction service provider (may take 2 working days).

Step 3: Transfer of EMD amount to his global EMD wallet: Online /Off-line transfer of funds using NEFT / Transfer, using challan generated on E-auction portal. Step 1 to Step 3 should be completed by bidder well in advance, before e-auction date. Bidder may also visit: https://BAANKNET.com for registration and

bidding guidelines THE ACCUSE OF THE PARTY OF THE PARTY NEW YORK

Name	Team	Number	o-Mail
Helpdesk Number	PSB Alliance	8291220220	support.ebkray@psballiance.com support.ebkray@procure247.com
Mr. Dharmesh Asher	PSB Alliance	9892219848	avp.projectmanager2@psballlance.com
Mr. Sudhir Panchal	iSourcing Technology	8160205051	sudhir@procure247.com

 Intending bidders shall hold a valid e-mail address, for further details and query please contact BAANKN Helpdesk Number 8291220220 Helpline e-mail ID support.BAANKNET@psballiance.com and support.ebkray@procure247.com

To the best of knowledge and information of the authorized officer there is no encumbrances on the property/les. However, the intending bidders. should make their own independent inquiries regarding the encumbrances, title of the property/les put on auction and claims/rights/dues effecting the property, prior to submitting their bid. The e-auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The authorized officer/secured creditor shall not be responsible in any way for any third party claims/rights/dues. No claim of whatsoever nature will be

entertained after submission of the online bid regarding property/ies put for sale. Earnest money deposit (EMD) shall be deposited through RTGS/NEFT/Fund Transfer to the bank account as guided and mentioned in

https://BAANKNET.com portal before participating in the bid online. The KYC documents are 1.Proof of Identification (KYC) viz. Voter ID Card/Driving License/Passport 2. Current Address Proof for communication 3.

PAN Card of the bidder 4. Valid e-mail ID/contact number of the bidder etc. Date of inspection will be as mentioned in the table above with prior appointment with above mentioned contact numbers.

Prospective bidders may avail online training on e-auction from: https://BAANKNET.com.portal.

7. Bids shall be submitted through online procedure only in the prescribed formats with relevant details.

8. Bidders shall be deemed to have read and understood the terms and conditions of sale and be bound by them.

9. The bid price to be submitted shall be above the reserve price and bidders shall improve their further offers in multiples of Rs. 1.00 Lakh (Rupees One Lakh) for Reserve Price up to Rs. 5 Crore/ 5.00 Lakhs (Rupees Five Lakhs) for Reserve price above Rs.5 Crore -up to Rs.9.00 Crore/ and 10.00 Lakhs (Rupees Ten Lakhs) for Reserve Price above Rs.9 Crore. It shall be the responsibility of the interested bidders to inspect and satisfy themselves about the property before submission of the bid.

11. The earnest money deposit (EMD) of the successful bidder shall be retained towards part sale consideration and the EMD of the unsuccessful bidder

will be returned on the closure of the e-auction sale proceedings. 12. The earnest money deposit shall not bear any interest the successful bidder shall have to pay 25% of the purchased amount (including earnest money already paid immediately on acceptance of bid price by authorized officer on the same day or maximum by next day and the balance of the sale price on or before 15th day of sale. The auction sale is subject to confirmation by the bank. Default in deposit of the amount by the successful bidder at any stage would entail forfeiture of the whole money already deposited and property shall be put to re-auction and the defaulting bidder shall have no claim/right in respect of the property/amount.

13. The prospective qualified bidders may avail online training on e-auction from : https://BAANKNET.com portal prior to the date of e-auction neither the authorized officer nor the bank will be held responsible for any internet network problem power failure, any other technical lapse/failure etc. in order to ward off such contingent situation the interested are requested to ensure that they are technically well equipped with adequate power backup etc. for successfully participating in the e-auction event.

14. Purchaser shall bear the stamp duties charges including those of sale certificate / registration/ charges including all statutory dues payable to the government, taxes and rates and outgoing both existing and future relating to the property.

 Buyer shall bear the TDS wherever applicable including other statutory dues, registration charges, stamp duty etc. 16. The authorized officer/ bank is not bound to accept the highest offer and has absolute right and discretion to accept or reject any or all offers or adjourn

/postpone/cancel the e-auction or withdraw any property or portion there-of from the auction proceeding at any stage without assigning any reason there for.

The sale certificate will be issued in the name of the purchaser(s)/applicant(s) only and will not be issued in any other name(s).

18. The sale shall be subject to rules/conditions prescribed under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002. Further details inquiries if any on the terms and conditions of sale can be obtained from the contact numbers given.

19. If any participant deposits the EMD after registering himself and afterwards opt to not to bid, can reverse the bid amount through system as specified in: https://BAANKNET.com.portal.

GST, wherever applicable, to be borne by successful bidder.

SALE NOTICE TO BORROWER/ GUARANTORS

The undersigned being the Authorized Officers of Bank of India are having full powers to issue this notice of sale and exercise all powers of sale under securitization and reconstruction of financial assets and Enforcement of Security Interest Act, 2002 and the rules framed there under. You have committed default in payment of the dues with interest, cost and charges etc. in respect of the advances granted by the bank mentioned above. Hence, the Bank has issued demand notices to all of you under section 13(2) to pay the amount mentioned there on within 60 days. You have failed to pay the amount even after the expiry of 60 days. Therefore, the Authorized Officers in exercise of the powers conferred under section 13(4), took possession of the secured assets more particularly described in the schedule mentioned above. Notice is hereby given to you to pay the sum as mentioned above before the date fixed for sale, failing which the property will be sold and balance due if any will be recovered with interest and cost from you. Please note that all expenses pertaining to demand notice, taking possession, valuation and sale of assets etc. shall be first deducted from the sale proceeds which may be realized by the undersigned and the balance of the sale proceeds will be appropriated towards your liability as aforesaid. You are at liberty to participate in the auction to be held on the terms and conditions thereof including deposit of earnest money.

Date: 04.02.2025 Place: Mumbal

Authorized Officer Bank of India

AXIS FINANCE LIMITED

Corrigendum

Kindly refer to our E-Public Auction cum Sale Notice dated 27th January, 2025 pertaining to the Public Auction of the Secured assets of freehold immovable property Office No. 313 on 3th Floor in the scheme known as "SANKALP ICON" Ahmedabad, Gujarat more particularly described in schedule -I of the said Notice. In the said E-Public Auction cum Sale notice, the auction date in the first paragraph has been inadvertently mentioned as "28th has been inadvertently mentioned as "28" February, 2025" which is to be read as "5" March 2025". The said date is correctly mentioned in the schedule II of the notice. Except for the correction as mentioned above, there is no change in the E-Auction Sale Notice dated 27th January, 2025. The inconvenience caused in this regard is Authorized Officer Axis Finance Limited

IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) CIN: L65110TN2014PLC097792 Registered Office: KRM Towers, 8" Floor, Harrington Road,

IDFC FIRST

APPENDIX IV [Rule 8(1)]
POSSESSION NOTICE (For immovable property)

Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 14.09.2024 calling upon the borrower, co-borrowers and guarantors 1. DEV MINERALS & CHEMICALS, 2. MUKESHKUMAR MANUBHAI VORA, 3. SONAL MUKESHKUMAR VORA, to repay the amount mentioned in the notice being Rs. 63,52,409.25/- (Rupees Sixty Three Lac Fifty Two Thousand Four Hundred Nine and Twenty Five Paise Only)

as on 13.09.2024 within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under subsection (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules. 2002 on this 31" day of JAN 2025.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 63,52,409.25/- (Rupees Sixty Three Lac Fifty Two Thousand Four Hundred Nine and Twenty Five Paise Only) and interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable properties

All That Piece And Parcel Of Property Residential House On Land Admeasuring 130-04 Sq. Mtrs. Of Sub-plot No. 16/b Of Plot No. 16 Of "Shree Amruta Co. Op. Housing Society Ltd (reg. No. Gh-2819, Dt.22.07.1968)* Of RSN 94, 95 & 96p Of Village: Raiya, Tal. & Subdistrict: Raikot, Reg. District: Raikot, District: Raikot In The State Of Gujarat-360007 And Bounded As: East: 7.62 Mtrs. Wide Road, West: Other's Property Of Plot No. 15, North: Other's Property Of Plot No. 13, South: Other's Property Of Plot No. 16/A

Sd/- Authorised Officer Date: 31-01-2025 IDFC First Bank Limited Place : GUJARAT (erstwhile Capital First Limited and Loan Account No : 48083713. 18941745 & 32936662 amalgamated with IDFC Bank Limited)

डेयन बेंक 🤲 Indian Bank

A SCHERMIZ ALLAHABAD

Bharuch Branch: 25-27, Golden Plaza, M.G. Road, BSNL Office, Bharuch-392001. POSSESSION NOTICE

UNDER RULE 8 (1) OF SECURITY INTEREST ENFORCEMENT RULES 2002 (For Immovable Property)

The undersigned being the authorized officer of the Indian Bank, Bharuch Branch, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12), 13(2) rea with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice date: 12.06.2024 calling upon the Borrowers Mrs. Nitixaben Anilkumar Jaguwala (Borrower & Mortgagor) & Mr. Anilkumar Surendralal Jaguwala (Guarantor), to repay the amount mentioned in the notice being Rs. 10,20,605.28 (Rupees Ten lakh Twenty Thousand Six hundred Five And Twenty Eight Paisa Only) within 60 days from the date of receipt of the

The borrower/Co-Borrower/Mortgagor having failed to repay the amount, notice is ereby given to the borrower/guarantor and the public in general that the undersigned has aken Physical Possession of the property described herein below in exercise of powers onferred on him/her under Sub-Section (4) of Section 13of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this 02nd day February of the year 2025.

The borrower/Co-Borrower/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank, Bharuch Branch, for an amount of Rs. 10,20,605.28 Rupees Ten lakh Twenty Thousand Sixhundred Five And Twenty Eight Paisa Only) as on 11/06/2024 + further interest and other expenses thereon.

"The Barrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All That Piece Parcels of Free Hold immovable Property Situate at District Bharuch, Sub District Ankleshwar, Village Andada, Taluka Ankleshwar, R. Su. 134/2, Plot No. 15/A, Total Area 699.18 Sq. Mts, Paiki 463.82 Build Up Vinayak Complex, 3rd Floor, Flat No. 307, Build up Area 44.46 Sq. mts. In The Name of Mrs. Nitixaben Anilkumar Jaguwala, Bounded by: . North: Mandava Road, . South: Re. su. No. 134/2 Paiki Open Land, • East: Flat No. 306, • West: Re. Su. No. 134/2 Paiki Open Land

Date: 02.02.2025 **Authorised Officer** Place: Bharuch Indian Bank



Exh. No. 14 R.P No. 137 OF 2023

Union Bank of India

... Certificate Holder

M/s. Shree Udyog & Ors. Certificate Debtor NOTICE FOR SETTLING THE SALE PROCLAMATION

CD-1 M/s. Shree Udyog, (Through its Proprietor Mr. Jaiendra Natvarlal Bhavsar) Residing at: - Flat No. F/503, 5th Floor, Indraprastha Building, Behind Ayappa Temple. Mira Road (East), Thane-401107. And At: - Goyal Tower Building, Bi71, 7th Floor, Panjara Pole, Char Rashtra, Opp. Gulby Police Chowki, Ahmedabad-380015. Also, At: - C/o. B.S Hydracarbon Pvt. Ltd., 405/406, Kane Plaza Link Road, Malad (West).

CD-2. Mr. Shreeram B. Iyer, Residing At. - A-501, 5th Floor, Varun Apartment, Versova Link Road, Near Ganganagar Bus Stop, Andhen (West), Mumbai-400053. And At: - A/1501, Meera CHS., 15th Floor, New Link Road, Near Oshiwara Police Station, Andheri (West), Mumbai-400102. And At: - B/601-602, Vashal Ashiyana Gousai Compound, Nirmal Nagar, Near Ram Mandir, Bandra (East) Mumbai-400051. Also, At: - C/o B. S Hydracarbon Pvt. Ltd., 405/406, Kane Plaza Link Road, Malad

(West), Mumbai - 400064. Whereas the Hon'ble Presiding Officer has issued Recovery Certificate in O.A. No. 205 of 2014 to pay to the Applicant Bank Financial Institution a sum of Rs. 40,88,361,23 (Rupees Forty Lakh Eighty Eight Thousand Three Hundred Sixty One and Paise

Twenty Three Only) along with interestand cost, and Whereas you the CDs have not paid the amount and the undersigned has attached the

under-mentioned property and ordered its sale Therefore you are hereby informed that the 28.02.2025 has been fixed for drawing up the proclamation of sale and settling the terms thereof. You are hereby called upon to participate in the settlement of the terms of proclamation and to bring to the notice of

properties or any portion thereof. SCHEDULE OF IMMOVABLE/MOVABLE PROPERTY All That Piece and parcel of Flat No. B/601/602, Vishal Ashiyana, Nirmal Nagar Gousia Compound Bandra East, Mumbai - 400051.

the undersigned any encumbrances, charges, claim or liabilities attaching to the said

Given under my hand and the seal of the Tribunal on 28.01.2025.



(Deepa Subramanian) Recovery Officer -II Debts Recovery Tribunal -III

SAVARKUNDLA BRANCH, DIST. AMRELI Ph. 02845-224900, Email: cb5957@canarabank.com FORD ASPIRE Party Name : Mrs. Manjulaben Amrutial Chudasama (Legal heir of Late Mr. Pankajkumar Amrutial Chudasama) (Registration No. GJ-14-AK-8723)

केनरा बैंक Canara Bank

FOR SALE Interested parties may submitted bid in seal cover by 20.02.2025 upto 2 pm at above mentioned branch, Inspection Date : 12.02.2025 between 12 to 2 pm at above mentioned branch. Inspection Officer

8238005269. The highest price list will be

accepted for sale. The decision of the Bank shall be final and binding on all parties.

EMD BANK DETAIL: Canara Bank, Savarkundla Branch, Dist. Amreli. A/C No.: 209272434, IFSC: CNRB0005957 EMD Amount : Rs. 7,000/-Auction Amount : Rs. 70,000/-

AUCTION DATE: 21.2.2024 AT 4 PM

)) बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Navyug College Branch : Ground Floor: Ravi Raj Apartment, Near Navyug College, Rander Road, Dist. Surat - 395009, Phone : 0261-2287306, 2287307,

E-Mail: runsur@bankofbaroda.com APPENDIX IV [See rule 8(1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas. The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 28.10.2024 calling upon the borrower Mr. Manishkumar Naranbhai Chopra (Borrower), Mrs. Pushpaben Manishkumar Chopra (Co-Borrower), Mr. Kalpesh Naranbhai Chopra (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 10,04,759.67 as on 28.10.2024 + un applied interest there on + Legal & other Expenses within 60 days from the date of receipt of the said notice:

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under subsection (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 29th day of January of the year 2025.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, Navyeg College Branch for an amount of Rs. 10,04,759.67 as on 28.10.2024 +

un applied interest there on + Legal & other Expenses. The Barrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All right, title and interest in the Immovable Property bearing Flat No. 202, Super built up area admeasuring about 1026 sq. ft i.e. 95.35 sq. mtrs. and Carpet area admeasuring about 58.14 sq. mtrs. on the 2nd Floor in Building No. Lof B-Type Building in "VAISHNODEVI TOWNSHIP* along with undivided proportionate share admeasuring 32.78 sq. mtrs. in the land underneath the said building situated on the land bearing Revenue Survey No. 41, Block No. 49-A, admeasuring 25344 sq. mtrs at Village - Vankala, Sub Dist. Surat City, Dist. Surat. Property in the name of Mr. Manishkumar Naranbhai Chopra. Bounded by :- North Flat No. 201, East: Open Space, South: Building No. J. West: Flat No. 203.

Date: 29.01.2025, Place: Surat Authorised Officer, Bank of Baroda

बैंक ऑफ महाराष्ट्र

BANK OF MAHARASHTRA Fiesta, LP Savani road, Adajan Surat.

[Rule-8(1)] POSSESSION NOTICE (for Immovable Property) WHEREAS, The undersigned being the Authorized Officer of the Bank of Maharashtra under

the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of the powers conferred under Sub-Section (2) of Section 13 read with Rule 8 of the Security Interest (Enforcement) Rule, 2002, issued Demand Notice dated 27-12-2023 calling upon the Borrowers Mr. Abhay Bimal Singh (Borrower), Mrs. Jyoti Umashankar Singh (Borrower) to repay in full the amount as mentioned below within 60 days from the date of receipt of the said Notice.

The notice was sent by Hand Delivered/Registered AD post calling upon the Borrowers/Guarantors for payment of dues towards to the bank. The Borrowers/Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantors and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13 (4) of the said Act read with Rule 8 of the said rules on 02/01/2025.

The Borrowers/Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Bank of Maharashtra for an amount hereinabove mentioned.

(DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES)

ir.	Name of the Borrower/s /Guarantor/s	Description of Secured Asset (Immovable Properties)	Amount
	Mr. Abhay Birnal Singh (Borrower), ii) Mrs. Jyoti Umashankar Singh (Berrower)	All that piece and parcel of immovable (Residential) property bearing Block No. 513 at Plot No. 4/RS No. 353, TPS No. 62, Final Plot No. 143, Mahadev Nagar– 1, Godadara Dindoli Road, Cheryasi, Surat, Gujarat.	60296200640 Ledger Balance of Rs. 1208650.23 + unapplied

Date: 02-01-2025 Place: Surat

Sd/-, Authorized Officer, Bank of Maharashtra



AXIS FINANCE LIMITED

Axis House, C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai – 400 025 APPENDIX IV [See Rule 8(I)] POSSESSION NOTICE

(For immovable property)
[As per Appendix IV read with rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002] The undersigned being the Authorized Officer of the Axis Finance Limited (AFL), under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13 (12) read with the Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 26th July, 2024 calling upon the Borrower(s) / Guarantor(s) / Mortgagor(s) (1) SUDHIR DALSUKHBHAI KOTADIYA (Borrower/Mortgagor) (2) RANJANBEN SUDHIRBHAI KOTADIYA (Co-Borrower I) (3) DALSUKHBHAI P KOTADIYA (Co-Borrower II) (4)

MUKTABEN D KOTADIYA (Co-Borrower III) having address at: C/1003 Suvas Caspia, Near Ved Bunglows, Nava Nikol Nikol, Ahmedabad, Gujarat-382350 and also address: 84 Panina Taka Vistar, G Kubada, Kubada, Amreli, Gujarat- 365640 who have mortgaged the immovable property being all the piece and parcel of the land more particularly described below, to repay the amount mentioned in the notice being INR.1,15,76,156/- (Rupees One Crore Fifteen Lakh Seventy-Six Thousand One Hundred Fifty-Six Only) due as on 5th July, 2024 with further interest at the contractual rate thereon till the date of payment within 60 days from the date of receipt of the said notice. The Borrower(s) / Guarantor(s) / Mortgagor(s) having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) / Mortgagor(s) and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein

below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 2nd day of February of The Borrower(s) / Guarantor(s) / Mortgagor(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Axis Finance Limited for an amount of INR.1,22,45,376/-(Rupees One Crore Twenty-Two Lakhs Forty-Five Thousand Three Hundred and Seventy-Six Only) due as on 5th January, 2025 with further interest thereon at the contractual rates together with costs, charges, etc. of Axis Finance Ltd until the full payment or realization in full.

The Borrower(s) / Guarantor(s) / Mortgagor(s) attention is invited to provisions of sub section (8) & sub section (13) of section 13 of the said Act, in respect of time available, to

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Property details-

All that piece and parcel of freehold immovable property Office No. 313 on 3rd Floor having its carpet area admeasuring 148.08 sq. mtrs., together with undivided share in land admeasuring 75.99 sq. mtrs... with common facilities and amenities in the scheme known as "SANKALP ICON" constructed on Non-agricultural Land of Sub Plot No. 3 admeasuring 1868 sq. mtrs., made out of Final Plot No. 140 admeasuring 9834 sq. mtrs., (allotted in lieu of Survey No. 517/2/2) of Town Planning Scheme No. 111 situate, lying and being at Mouje Nikol Taluka Asarwa & District Ahmedabad and Registration Sub- District Ahmedabad-12 (Nikol) within the state of Gujarat. The property is bounded as under: East: Scheme Passage, North: T.P. Road, West: Scheme Margin, South: Office No. 312

Date: 2nd February, 2025

For Axis Finance Ltd

JANA SMALL FINANCE BANK | Registered Office: The Fairway, Ground & First Floor, Survey No.10/1, 11/2 & 12/2B, Off Domlur, Koramangla Inner

Ring Road, Next to EGL Business Park, Challaghatta, Bangalore-560071. NOTICE OF SALE THROUGH PRIVATE TREATY

SALE OF IMMOVABLE ASSETS CHARGED TO THE BANK UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002. (SARFAESI ACT)

The undersigned as Authorized Officer of Jana Small Finance Bank Limited has taken over Physical Possession of the schedule property under the SARFAESI Act. The Authorized Officer of Jana Small Finance Bank Limited, had already conducted multiple public auctions for selling the property, but they turned out to be unsuccessful as no bids were received. Hence please be informed that if the total outstanding dues in the aforesaid loan account are not paid within Fifteen (15) Days from the date of this publication of this notice, then the Authorized officer will proceed for sale via private treaty of the property as stated below. Public at large is informed that the secured property as mentioned in the Schedule are available for sale through Private Treaty, as per the terms agreeable to the Bank for

realization of Bank's dues. Standard terms & conditions for sale of property through Private Treaty are as under:

1. Sale through Private Treaty will be on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS".

2. The purchaser will be required to deposit 100% of the sale consideration on the expiry of publication of this notice. 3. In case of non-acceptance of offer of purchase by the Bank, the amount if any paid along with the application will be refunded without any interest with in the stipulated time.

4. The purchaser should conduct due diligence on all aspects related to the property (under sale through private treaty) to his satisfaction. The purchaser shall not be entitled to make any claim against the Authorized Officer / Secured Creditor in this regard at a later date.

5. The Bank reserves the right to reject any offer of purchase without assigning any reason. 6. The purchaser has to bear all stamp duty, registration fee, and other expenses, taxes, duties, society dues in respect of purchase of the property.

7. Sale shall be in accordance with the provisions of SARFAESI Act / Rules. Sr. Loan Account Name of Borrower/

Co-Borrowers

Rs.20,12,102.90 (Twenty Lakh Twelve Thousand One Hundred 1) Ranjitsinh Zala, Rs.4,75,000/- (Rupees Four Lakh 31799430000351 2) Geetaben Zala Two Rupees and Ninety Paise Only) as of 24/03/2023 Seventy Five Thousand Only) Details of Secured Assets: All that piece and parcel of Property of in Shop No.13 & 14 First Floor, Shivam Complex, Nr. Dharmali Bus Stand, Daramali, Sabar Kantha, Gujarat-383010 The aforesaid Borrower's/ Co-borrower's attention is invited to provisions of section 13(8) of SARFAESI Act for redemption of secured assets mentioned herein above by

Amount as per 13(2) Demand Notice under SARFAESI Act.

tendering the aforementioned outstanding dues together with all costs, charges and expenses incurred by the bank before the sale of secured assets. Correspondence Address: Mr. Yashaskar Sharma (Mob. No.9898335003), email: yashaskar.sharma29@janabank.com, Mr. Ranjan Naik (Mob. No.6362951653), email: ranjan.naik@janabank.com. Jana Small Finance Bank Limited, (formerly known as M/s, Janalakshmi Financial Services Pvt. Ltd.), having Office Ground Floor, 2nd Floor, Shangrila Arcade, Above Saraswat Bank, 100 Feet Anand Nagar Road, Shyamal, Ahmedabad, Gujarat-380015.

Ahmedabad

Reserve price for private treaty

financialexp.epapr.in

No.

Date: 04.02.2025, Place: Gujarat

Number

Sd/- Authorized Officer, Jana Small Finance Bank Limited

SHARAT INDUSTRIES LIMITED

NOTICE FOR RECORD DATE FOR FIRST AND FINAL CALL

ON PARTLY PAID-UP RIGHTS EQUITY SHARES

Requirements) Regulation 2015 and subsequent amendments thereto and approva

of the Board of Directors of the Company, notice is hereby given that the Company

has fixed Friday, 07th February 2025 as Record Date for the purpose of determining

the holders of the partly paid-up equity shares to whom the call notice will be

dispatched for the payment of the First and Final call on the Rights Issue Equity

Shares of 23.25 (Rupees Twenty-Three and Twenty-Five Paise only) (comprising

7.50/- towards Face Value and 15.75/- towards Premium), on rights basis pursuant

ડોએચ્ચ બેંક - એજી

જત નીચે સહી કરનાર તે ડોએચ્ચ બેંક એજી, ભારત ("બેંક") ના અધિકૃત અધિકારી

તરીકે સિક્યરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓર્ફ ફીનાન્સીયલ એસેટ્સ એન્ડ

એન્કોર્સમેન્ટ ઓક સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૧૨) ને

સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ સાથે નિયમ ૩ વાંચતા મુજબ

આપવામાં આવેલ અધિકારોની રૂઈએ **તારીખ ૦૮-૦૭-૨૦૨૧** ના રોજની ડીમાન્ડ નોટીસ

બજવણી કરીને ઋણ લેનાર (૧) વિવાન ક્રિએશન એલએલપી (૨) લાલવાણી મનીપ

રમેશ (૩) લાલવાણી રમેશચંદ લક્ષ્મણદાસ (૪) લાલવાણી સુનીતા (૫) લાલવાર્ણ

સપના ને નોટીસમાં જણાવેલ રકમ રૂા. ૨,૫૬,૭૯,૪૬૪.૪૬/- (અંકે રૂપિયા બે કરોડ

છપ્પન લાખ ઓગણ્યા એસી હજાર ચારસો ચોસઠ અને પૈસા છેતાલીસ પુરા) (કેશ

ક્રેડીટ કેસીલીટ રૂા. ૨,૧૬,૬૧,૨૩૦.૩૭/- ની લોન દ્વારા એકાઉન્ટ નં.

૧૦૦૦૩૯૩૧૭૫૪૦૦૧૯ અને સરકારી ઈમરજન્સી ક્રેડીટ લાઈન ની રૂા.૪૦,૧૮,૨૩૪.૦૯/- લોન દ્વારા એકાઉન્ટ નં. ૩૨૦૦૩૯૩૧૭૫૪૦૦૧૯)

૨૮/૦૬/૨૦૨૧ તારીખ સુધી, સદરહુ નોટીસ મળ્યાની તારીખથી દિન-૬૦ માં ભરપાઈ

કરજદાર સદરહુ રકમ ભરપાઈ કરી આપવામાં નિષ્ફળ ગયેલ હોવાથી કરજદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે, નીચે સહી કરનારે તેઓને આપવામાં

આવેલ અધિકારોની રૂઈએ સદરહુ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ તેને/તેણી ને સદરહુ

કાયદાના નિયમ-૮ સાથે વાંચતા અમદાવાદના માનનીય પમા એડિશનલ ચીક

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષના પાલનમાં, સરફેસી કેસ નં. પદ૨૭/૨૦૨૪, ઓર્ડર

તા.૦૫/૧૧/૨૦૨૪ આ અધિનિયમની કલમ ૧૪ હેઠળ તારીખ ૦૨ કેબ્રુઆરી ૨૦૨૫

ખાસ કરીને કરજદાર ને અને જાહેર જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે

સદરહુ મિલકત સંબંધે કોઈપણ વ્યવહાર કરવો નહિ અને સદરહુ મિલકત સંબંધે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર બેંક ના રૂા. ૨,૫૬,७૯,૪૬૪.૪૬/- (અંકે રૂપિશા બે કરોડ

છપ્પન લાખ ઓગણ્યા એંસી હજાર ચારસો ચોસઠ અને પૈસા છેતાલીસ પુરા) (કેશ કેડીટ કેસીલીટ રૂા. ૨,૧૬,૬૧,૨૩૦.૩૭/- ની લોન દારા એકાઉન્ટ નં

૧૦૦૦૩૯૩૧૭૫૪૦૦૧૯ અને સરકારી ઈમરજન્સી કેડીટ લાઈન ની ૩ા

૪૦,૧૮,૨૩૪.૦૯/- લોન દ્વારા એકાઉન્ટ નં. ૩૨૦૦૩૯૩૧૭૫૪૦૦૧૯) અને તેના ઉપર વ્યાજ, અમદાવાદના માનનીય પમા એડિશનલ ચીક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ

સમક્ષના પાલનમાં, સરફેસી કેસ નં. પદ૨૭/૨૦૨૪, આ અધિનિયમની કલમ ૧૪

કરજદારનું ધ્યાન અધિનિયમની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ તરફ આમંત્રિત કરવામાં આવે છે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં સિક્યોર્ડ અસ્કથામતો રિડમ

स्थावर भिलंडत - ९ लुं वर्शनः

તે તમામ દસ્તાવેજ અને વ્યાજ તે મિલકતના તમામ ભાગ અને હિસ્સા ઉપર તેવી મિલકત

ના તમામ હક, સી/દ ૨, દકા માળે, ક્ષેત્રફળ ૩૩૦ ચો. વાર્ડ સુપર બિલ્ટ અપ (એલોટમેન્ટ

પત્ર પ્રમાણે ૨૫/૦૮/૨૦૨૧ના રોજ) ન્યુઅશ્વમેઘ માં, બોડકદેવ કો-ઓપરેટિવ

હાઉસીંગ લિમિટેડ સ્ક્રીમ ગેલેક્સી ના નામે ઓળખાય છે. તે સર્વે નં. ૨૪૮ પૈકસી

એફ.પી. નં. ૩૮૯ ટી.પી.એસ. નં. ૧/બી, મૌજે બોકડદેવ તાલુકો : ઘાટલોડિયા જીલ્લે

ના રોજ નીચે જણાવેલ મિલકતનો કબજો લઇ લીધેલ છે.

હેઠળ ૦૫/૧૧/૨૦૨૪ ના રોજ ઓર્ડર કરવામાં આવેલ છે.

to the Letter of offer dated 04" July 2024.

Place: Nellore Date: 03" February 2025

ङअष्य नोटिस

કરી આપવા માટે જણાવેલ છે.

કરવા માટે.

41" : 08-05-505A

SIDIBHIS: OBS

Pursuant to Regulation 42 of the SEBI (Listing Obligation and Disclosure

CIN: L05005AP1990PLC011276 napalem Village, T.P.Gudur Mandal, Nellore District, AP Pin 524002.

SHARAT REDDY SABBELLA

WHOLE-TIME DIRECTOR DIN:02929724

(એਪੇਰਿੱડੇક્સ IV (ਗਿਕਮ c(੧))

ઝોનલ ઓફિસ સુરત : બીજો માળ, માઇલસ્ટો ફિયેસ્ટા, એલ પી સવાણી રોડ, અડાજણ, સુરત [નિયમ - 8(1)] કબજાની સૂચના (સ્થાવર મિલકત માટે)

બેંક ઓફ મહારાષ્ટ્ર

જ્યારે, બેંક ઓફ મહારાષ્ટ્રના અધિકૃત અધિકારી તરીકે, સિક્યોરિટાઇઝેશન એન્ડ રિક-સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ, અન સિકપોરિટી ઇ-ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વાંચેલા કલમ ૧૩ ની પેટા-કલમ્ (ર) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ૧૧-૧૧-૨૦૨૪ ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં દેવાદારો શ્રી સાગર બાલુભાઈ આહિર દિણદાર), શ્રીમતી મનીપાબેન ભવાનભાઈ રાઠોડ (દેણદાર) ને ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી ૧૦ દિવસની અંદર નીચે દશ્ચવિલ ૨૭મ સંપૂર્ણ રીતે ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું.

આ નોટિસ બેંકને બાકી રકમ ચૂકવવા માટે હાથથી પહોંચાડાયેલ/રજિસ્ટર્ડ એડી પોસ્ટ દ્વાર મોકલવામાં આવી હતી. ઋણ લેનારાઓ/ગેરેટરો રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, ઋણ લેનારાઓ/ગેરેટરો અને સામાન્ય જનતાને સૂચના આપવામાં આવે છે કે નીચે સહી કરનારે 30/04/૨૦૨૫ ના રોજ ઉપરોક્ત નિયમોના નિયમ ૮ સાથે વાંચેલા કાયદાની કલમ ૧૩ (૪) હેઠળ તેમને/તેણીને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે વર્ણવેલ મિલકતનો સાંકેતિક કબજો લીધો છે. ખાસ કરીને ઋણ લેનારાઓ/ગેરંટરો અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે તેઓ

મિલકતો સાથે વ્યવહાર ન કરે અને મિલકતો સાથેના કોઈપણ વ્યવહાર ઉપર ઉલ્લેખિત રકમ માટે બેંક બોફ મહારાષ્ટ્રના ચાર્જને આધીન રહેશે.

(સ્થાવર મિલકતોનું વર્ણન)

લેનારા/ઓ/નું સુરક્ષિત વર્ણન સંપત્તિ (સ્થાવર મિલકતો) નામ બાંયધર્ર આપનાર/ઓ બધી જ સ્થાવર મિલકતનો ટુકડો મેકાઉન્ટ નં. 60369527607 થી સાંગર બાલુબાઇ આતીર (ઉધાર લેનાર) અને ત બધા જ રથાવર દામકાના ફુકડા અકાઉન્ટ ન 001993ના વર્ગ અને ભાગજે પહોર્ટ ને. 69 (મેંજૂટ પ્લાન પહોર નં. 7/69 મુજબ), કૃપલકુંજ રેસીડેન્સી, વીર રેસીડેન્સીની સામે, ભાગ 3રાયેલ વ્હાજ - તૈના પર આરડોલી રોડ, ગ્રામ નેત્રંગ સબ- 9.55% વાર્ષિક વ્હાજ - 2% વાર્ષિક ii) શ્રીમતી મનીપાબેન ભવાનભાઈ શઠોડ (ઉથાર લેનાર) જિલ્લો કામરાજ, સુરત, ગુજરાત

ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી બેંક ઓફ મહારાષ્ટ્ર त्यशिषः 30/01/2025

એક્સીસ ફાયનાન્સ લીમીટેડ

પશ્ચિષ્ટ-૪

(જુઓ નિયમ ૮(૧)) કળજા નોટીસ

(સક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ક્રોસેમેન્ટ) નિશ્વમે, રચલ ના નિશ્વમે (સાંદર મિલકત માટે)
(સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ક્રોસેમેન્ટ) નિશ્વમે, રચલ ના નિશ્વમ ૮(૧) સાથે વેશાતા પરિશિપ્ટિ ક મુજબ) અશ્રી, એક્સિસ કાશનાન્ય (મિટિડ (એએફ્સેસ) ના નીકે સહી કરનાર અશિક્સ હોઇ કોઇએસે. (સ્ક્રોસેસિટ) કિન્સ કેઇક્સ કાશનાન્ય (મિટિડ (એએફ્સેસ) ના નીકે સહી કરનાર અશિક્સ ઓફ કોઇનોરિટી ઇન્ટરેસ્ટ એક્ક, રચલ ફેડળા પ્રાપ્ત સાથે લોક કોઇક્સ હોઇનોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફ્રોસેમિટ) નિશ્વમે, રચલ ના નિશ્વમ કાશની વેશાની કરે કેઇક્સ રસલ કરે કેઇક્સ રસલ કરે કેઇક્સ સાથે ના કાશની ક્રિક્સ (એન્ફ્રિક્સ) (એન્ફ્રિસ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિસ) (એન્ફ્રિક્સ) (એન્ફ્રિક્સ

ાંજે રહીંધા રહેલા. કોર્ટ્સ પરત મેળાવામા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં ગણાવેલ એક્ડની કલમ ૧૩ ની પેટા કલમ (૮) કરતો પ્રત્યે દેવાદારા (ગે)/જામીનદાર(સે)/ ગીરવેદાર(સે) નું ધ્યાન દોરવામાં આવે છે.

સિક્યોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબા સમધના સંબંધમાં જ્યાવેલ એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮

ની જોગલાઇઓ પ્રત્યે દેવાદાર(રો)/જામીનદાર(રો)/ ગીરવેદાર(રો) નું દથાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતની વિગત

ઓફીસ નં. ૩૧૩, ૩પો માળ, કાર્પેટ એરિયા સેંગ્રફળ ૧૪૮.૦૮ શો.મી., તેમજ ન વઢેશાયેલ જમીનનો હિસ્સ ક્ષેત્રફળ કપ.લ્લ સો.મી., તેમજ કોમન સવલતો અને સુવિધાઓ ધરાવતી સંકલ્પ આઇકોન તરીકે જાણીતી સ્ક્રીમમાં, સબ પ્લોટ નં. ૩, ક્ષેત્રફળ ૧૮૬૮ શો.મી., ફાઈનલ પ્લોટ નં. ૧૪૦ ક્ષેત્રફળ ૯૮૩૪ શો.મી. (સર્વે નં પવક/૨/૨ ની બદલીમાં કાળવાશેલ) ટાઉન પ્લાનિગ સ્કીમ નં. ૧૧૧ ની બિન-ખેતીલાગ્રક જમીન પર બંધારોલ મોર્જ-નિકોલ, લાલુકો-સસારવા અને વિદ્યો અમદાવાદ અને રસુરદેશન સબ-ઉસ્ટ્રીક્ટ અમદાવાદ-વ (નિકોલ),ગુજરાત રાજ્ય ખાતેની ફી ઢોલ્ડ સ્થાવર મિલકતના તમામ ભાગ અને ઢિસ્સા. **મિલકતની ચતુઃસીમા** : પુર્લ : સ્કીમનો પેશેજ, ઉત્તર : ટીપી શેડ, પશ્ચિમ : સ્કીમનું માર્જીન, દક્ષિણ : ઓફીસ નં. ૩૧૨.

તારીખ : ૨ ફેબ્રુઆરી, ૨૦૧૫ એક્સીસ કાંચળાન્સ લીમીટેડ વતી અધિકૃત અધિકારી

Oriental Aromatics Ltd.

સદ/- કોએચ્ચ બેંક - એજી

અધિકૃત અધિકારી

Regd. Office: 133, Jehangir Building, 2nd Floor, M.G. Road, Mumbal - 400 001. CIN: L17299MH1972PLC285731

Unaudited Financial Results for the Quarter and Nine Months period ended 31st December 2024. ₹ In Lakh (Except per share data)

	1		Standalone		Consolidated		
Sr.No	Particulars	Quarter Year Ended Ended	Ended	Quarter Ended 31.12.2023	Quarter Ended 31,12,2024	Year Ended 31.03.2024	Quarter Ended 31.12.2023
Desire							
			Unaudited	Unaudited	Audited	Unaudited	
11.	Total Income from Operations (Net)	22,269.04	84,373.03	19,956.82	22,265.90	84,368.52	19,956.82
2	Net Profit/Loss for the period (before tax)	1,408.84	1,450.33	455.31	987.68	1,405.47	443.72
3	Net Profit/Loss for the period (after tax)	1,069.67	948.18	270,73	714.37	910.42	260.95
4.	Total Comprehensive Income for the period	1,066.83	938.30	269.23	711.53	904,58	259.45
5.	Paid-up Equity Share Capital (FV of Rs.5/- each)	1,682.68	1,682.68	1,682.68	1,682.68	1,682.68	1,682.68
6	Earnings per Share (EPS)		To a second				3.300 (0.10
	- Basic & Diluted EPS	3.18	2.82	0.80	2.12	2.71	0.78

Notes: 1) The above Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on February 3, 2025. The statutory auditors of the Company have reviewed the financial results for the quarter and nine months period ended in terms of Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 and have issued their review reports with unmodified conclusion on the unaudited Consolidated and Standalone Financial Results. 2) The full format of above extract of Financial Results, together with the Report of the Statutory Auditors are available on website of the Stock Exchanges vis www.bseindia.com & www.nseindia.com and also under "Investor Relations" link of Company's website www.orientalaromatics.com. The same can be accessed by scanning the QR code provided below: For Oriental Aromatics Ltd.

Date : 03/02/2025



Company Secretary & Compliance Officer



AMEX LIMITED

CIN: L17100GJ1989PLC013041

Registered Office: Camex House, 2nd Floor, Stadium- Commerce Road, Navrangpura, Ahmedabad-380009. Tel: +91-79-26462123 • Fax: +91-79-26462260 • Email: cs@camexltd.com • Website: http://www.camexltd.com Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2024

Sr.		Financial Results								
No.	Particulars -	Q	uarter Ende	d	Nine Months Ended		Year Ended			
110.		31-12-24	30-09-24	31-12-23	31-12-24	31-12-23	31-03-24			
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited			
1	Total Revenue from operations (net)	2856.30	3554.57	3489.00	9,827.61	10,504.53	14,288.28			
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	(42,56)	201.11	154.24	240.05	255.14	464,32			
3	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items)	(48.39)	201.11	154.24	234.22	255.14	464.32			
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional items)	(31.86)	145.68	116.32	174.70	191.09	346.25			
5	Total Comprehensive Income for the period	15	75		7.50	V7.4	(2.08)			
6	Paid up Equity Share Capital (Face value of Rs.10 each)	1020.87	1020.87	1020.87	1020.87	1020.87	1020.87			
7	Reserve (excluding Revaluation Reserves) as per Balance sheet of previous accounting year	(+)	-	(+)	3.8	H:	3,074.38			
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -									
	Basic	(0.31)	1.43	1.14	1.71	1.87	3.37			
	7	14.44	3							

Notes:

Place: Ahmedabad

Date: 03/02/2025

1. These financial results were reviewed by the Audit Committee, and were approved by the Board of Directors and taken on record by the Board of Directors at their meeting held on February 03, 2025. The above results for the quarter and nine months ended on December 31, 2024 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognised accounting practices and policies to the extent applicable.

2. The format of the unaudited quarterly and year-to-date results as prescribed in SEBI's Circular CIR/CFD/CMD/15/2015 dated 30th November, 2015 has been modified to comply with the requirements of SEBI's Circular dated 5th July, 2016, Ind AS and Schedule III [Division II] to the Companies Act, 2013.

3. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the websites of the Stock Exchanges, www.bseindia.com and on the Company website www.camexitd.com. For and on behalf of the Board

CAMEX LIMITED

Rajesh Nahata Whole Time Director (DIN:00278873)

મુંબઇ ઋણ વસુલાત અધિકરણ નં.૩. નાણાં મંત્રાલેચ, ભારત સરકાર સેક્ટર ૩૦એ, રઘુલીલા મોલ પછી, વાશી રેલ્વે સ્ટેશન પાસે, વાશી, નવી મુંબઇ– ૪૦૦૭૦૩ આર.પી. નં. ૧૦૨૩ નો ૧૩૬

યુનિયન બેંક ઓફ ઇન્ડિય .. સર્ટીફીકેટ હોલ્ડ

મેસર્સ થ્રી ઉદ્યોગ અને અન્ય .. સહીંફીકેટ દેવાદા વેશાણ દોષણા સેટલ કરવા માટે નોટીસ સ.કે. નં.૧ : મે. શ્રી ઉદ્યોગ, (તેના પ્રોપરાયટર શ્રી ઉંગેન્દ્ર નટવરલાલ ભાવસાર મારફતે)

રહેવાસી : ફ્લેટ નં.એફ/પ૦૩,પમો માળ,ઈન્દ્રપ્રસ્થ બિલ્ડીંગ, અથપ્યા મંદિરની પાછળ, મીસ રોક (પુર્વ) થાળે-૪૦૧૧૦૦ **ખાતે. અને** : ગોચલ ટાવર બિલ્ડીંગ, બી/૭૧, ૭મો માળ, પાંજરા પોળ, શાર રસ્ત ગુલબાઈ પોલીસ સોકીની સામે, અમદાવાદ-૩૮૦૦૧૫ ખાતે. <mark>ખાતે પણ</mark>; સી/ઓ બી.એસ. ઠાઈફાડાળંન પા. લિ., ૪૦૫/૪૦૬, ડેન પ્લાઝા લિંડ રોડ, મલાડ (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૬૪.

સ.દે. નં.૨ : શ્રી શ્રીરામ બી. ઐશ્વર, રહેવાસી : એ-૫૦૧, પમો માળ, વરૂપ એપાર્ટમેન્ટ, વરસોવા લિંડ રોડ, ગંગાનગર બસ સ્ટોપ પાસે. અંદોરી (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૫૩. **અને** : એ/૧૫૦૧, મીર સીએચએસ, ૧૫મો માળ, ન્યુ લિંક શેડ, ઓલીવાસ પોલીસ સ્ટેશન પાસે, અંધેરી (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૧૨ **ખાતે. અને** : બી/૬૦૧~૬૦૨, દાજાલ આશિયાના ગીસાઈ કમ્પાઉન્ડ, નિર્મલ નગર, સમ મંદિર પાસે, બાન્ડ્રા (પુર્વ) મુંબઇ-૪૦૦૦૫૧. **અહીં પણ પણ** : સી/ઓ બી.એસ. ઉદ્યોદ્ધાદ્રાબંન પ્રા. લિ. ૪૦૫/૪૦૬, ટેન પ્લાઝા લિંક સેડ, મલાડ (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૬૪.

પ્રાાવાનું કે નામદાર પ્રમુખ અધિકારીએ અરજાદર બેંક ફાયનાન્સિયલ ઇન્સ્ટ્ર્યુયુલનની સ્કમ ગ્ર ૪૦,૮૮,૩૬૧.૨૩/- (રૂપિયા શાલીસ લાખ ઇડ્યાંસી હજાર ત્રણસો એહસઠ અને તેવીસ પૈસા પુરા) તેમવ લ્યાજ અને ખર્સ સુકવવા માટે ઓ.એ. નં.૨૦૧૪ નો ૨૦૫માં રીકવરી સર્ટી ફીડેટ જ્લારી કરેલ છે અને અને તમે સટીફીકેટ દેવાદાર રકન ચુકવેલ નથી અને નીચે સહી કરનારે નીચે જણાવેલ મિલકતો ટાંચમા લીદોલ છે અને તેના વેચાલનો આદેશ આપ્યો છે.

આર્થી તમોને જાણ કરવામાં આવે છે કે વેસાણની દોપણા અને તેની જસ્તોના આવેખન માટે નિય કરાશેલ છે. આશી તમોને વેસાળની ઘોપણાની શસ્તો સેટલ કરવામાં ભાગ લેવા અને જ્ણાવેલ મિલકતે અને તેના હોઇ હિસ્સા સાથે સંકળાયેલ કોઇપણ બોજા, શાર્જિસ, દાવા અને લાયબીલીટી પ્રત્યે નીશે સહી કરનારનું ધ્યાન દોરવા વળાવામાં આવે છે.

સ્થાવર/જંગમ મિલકતનું શીક્ષુલ કુલેટ નં. બી/દુ૦૧/દુ૦૨, વિશાવ આશિયાના, નિર્મલ નગર, ગૌસીયા કમ્યાઉન્ડ, બાન્દ્રા પૂર્વ, મુંબઇ

મારી સહી અને અધિકરણના સિક્લ હેઠળ આ ૨૮.૦૧.૨૦૨૫ ના રોજ આપવામાં આવ્યું.

(દીપા સુબમણીસમ) વસુલાત અદિકારી-ઋણ વસુલાત અધિકરણ-3

PROTECTING INVESTING FINANCING ADVISING

રજીસ્ટર્ડ ઓફીસ : ઇન્ડિયન રેચોન કંપાઉન્ડ, વેરાવળ, ગુજરાત-૩૬૨ ૨૬૬

ઓફ્રીસ : આદિત્ય બિરલા હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ, 300, ગીજો માળ, તર્હિસ બિલ્ડીંગ, પરિમલ ગાર્ડન સામે, પંચવટી કોસ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૬ ૧. એબીએથએફએલ : ક્રી સુરેન્દ્રસિંઠ ચૌઠાણ – ૯૧૯૦૯૯૯૯૯૭૬ **હરાજી સર્વિસ પ્રદાતા (એએસપી)** : – મેસર્સ ઇ–પ્રોક્યુરમેન્ટ ટેકનોલોજીસ પ્રાઇવેટ લીમીટેડ (ઓક્શન ટાઈગર), શ્રી રામ ભર્મા : સપેર્ડ નં. ૮૦૦૦૦૨૩૨૯૬ અને ૯૨૬૫૫૬૨૮૧૯

સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ટ્રોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(ફ) ની જોગલાઇઓ સાથે લંચાલ સિક્યોરીટાઇટોશન અને રીકન્ટર્ક્સન ઓફ ફાયનાન્સિયલ એસ્ટ્રેસ અને એન્ટ્રોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકત(તો) ના વેચાણ માટે ઇ-હરાજી વેચાણ આથી ખાસ કરીને દેવાદાર(સે) અને જામીનદાર(સે) અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે દે

સ્થાવર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ

હે નીશે દર્શાવેલ સ્થાવર મિલહતો આદિત્ય બિરલા ઠાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ/સિક્યોર્ડ લેણદારને ગીરો/ચાર્જડ કરાયેલ છે, જેનો કબજો આદિત્ય બિરલા હાઉસિંગ કાયનાન્સ લીમીટેડ/સિક્યોર્ડ વેલદારના અદિકૃત અદિકારીએ લઇ લીધો છે, જે દેવાદારો એટલે કે **રળારી વિક્રમ અને રળારી રળાઇ**ડ પાસેથી આદિત્ય બિરલા ઠાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ/સિક્યોર્ડ લાલારની બાઠી ૨૭મ 🛊 **૧૪,૦૬,૫૦૬,૯૪/– (રૂપિયા શ્રીવીસ લાગ છ હજાર પાંચસો છ અને ચીરાણું પૈસા પુરા)** અને વસુલાતની તારીખ સુધી તેના પરના શક્ત વ્યાજ અને અન્ય ખર્શની વસુલાત માટે ૧૩.૦૩.**૨૦૨૫ ના** સેજ "જ્યાં છે", "જે છે" અને "જેમ છે" ના ધોરણે વેસાણ માટે મુકવામાં આવશે.

રીઝર્વ કિંમત રૂમ. ૮૧,૦૮,૮૫૦/- (રૂપિયા ભ્યાંસી લાખ છફ્યોત્તેર ઉત્તર સાહસો પથાસ પુરા) રહેશે અને અનેસ્ટ મનો ડિપોઝીટ (ઇએમડી) રૂમ. ૮,૨૦,૮૮૫/- (રૂપિયા આઠ લાખ સત્યાવીસ હનાર સાહસો પંચ્ચાસી પુરા) રહેશે. ઇએમડી જમા કરવાની છેતી તારીખ ૧૨.૦૩.૨૦૨૫ છે. જ્ણાવેલ મિલક્તના નિરિસાગની તારીખ ૧૧.૦૩.૨૦૨૫ ના રોજ સવારે ૧૧: ૦૦ થી સાંજે ૦૪,૦૦ વાગ્યા દરમિયાન નિયત

રથાવર મિલકતની વિગત

પ્લોટ નં. ૨૦૧, (ક્ષેત્રકળ આશરે ૩૧૪.૫૩ શો.મી. પ્લોટ એરિયા અને બાંધડામ ગ્રાઉન્ડ ક્લોર + પઠેલે માળ, કુલ સ્પલ્ સો.મી. રેગ્યુલાઇઝેશન સર્ટિફિડેટ મુજબ), જુનો જી લોર્ડ, દેવલશ્ચામ એપાર્ટમેન્ટ પાસે, એલડી માતૃ છાયા ઇગ્લીંશ મીડીયમ સ્કુલ પાસે, માચા સિનેમા રોડ, કુબેરનગર, મુકામ-સિટી સર્વે ને. ૯૯૮૧ તરીકે જાણીતી, મોર્જ-સરદારનગર, તાલુકો-અસારવા, વિદ્યો અને પેટા વિદ્યો-અમદાવાદ ગુજરાત-૩૮૨૩૪૦ ખાતેની રેસિડેન્સીયલ મિલક્તના તમામ ભાગ અને <mark>હિસ્સા. **સતુ:સોમા** : પ</mark>ુર્વ : શેડ/માર્જીન પછીનો શેડ, પશ્ચિમ : સિટી સર્વે નં. ૧૦૮૦, ઉત્તર : સિટી સર્વે નં. ૧૦૬૧, દક્ષિણ : સિટી સર્વે oi. 6668

વેસામની વિગતવાર શરતો અને નિસમો માટે, આદિત્ય બિરલા બાઉસિંગ ફારાનાન લીમીટેડ/સિક્યોર્ડ લેશદારની વેબસાઇટમાં આપેલ લિંહ એટલે https://homefinance.adityabirlacapital.com/properties-for-auction-under-sarfaesi-act ક્લાલા https://BestAuctionDeal.com જોવા વિનંતી છે.

તારીષ: ૦૪-૦૨-૨૦૨૫ (આદિત્ય વિરક્ષા નાઇસિંગ કાયનાન્સ સિમિટેડ) સ્થળ: અમદાવાદ

ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું.

[નિયમ - 8(1)] કબજાની સૂચના (સ્થાવર મિલકત માટે) ારે, સિક્ષ્પોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓ; સિકપોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ પેઠળ બેંક ઓફ મહારાષ્ટ્રના અધિકૃત અધિકારી તરીકે, અને સિકપોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વાંચેલા કલમ ૧૩ ની પેટા-કલમ (ર) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ૨૭-૧૨-૨૦૨૩ ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં ખાવી હતી, જેમાં દેવાદારો શ્રી અભય બિમલ સિંહ (દેણદાર), શ્રીમતી જ્યોતિ ઉમાશંકર સિંહ

બેંક ઓફ મહારાષ્ટ્ર ઝોનલ ઓફિસ સુરત : બીજો માળ, માઇલસ્ટો ફિયેસ્ટા, એલ પી સવાણી રોડ, અડાજણ, સુર

લેનારાઓ/ગેર્ટટરો અને સામાન્ય જનતાને સૂચના આપવામાં આવે છે કે નીચે સહી કરનારે 02/01/2025 ના રોજ ઉપરોક્ત નિયમોના નિયમ 8 સાથે વાંચેલા કાયદાની કલમ 13 (4) હેઠળ તેમને/તેણીને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે વર્ણવેલ મિલકતનો ભૌતિક કબજો લીધો છે. ખાસ કરીને ઋણ લેનારાઓ/ગેરંટરો અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે તેઓ

મિલકતો સાથે વ્યવહાર ન કરે અને મિલકતો સાથેના કોઈપણ વ્યવહાર ઉપર ઉલ્લેખિત રકમ માટે બેંક ઓફ મહારાષ્ટ્રના ચાર્જને આધીન રહેશે.

(દેણદાર) ને ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર નીચે દક્ષવિલ ૨કમ સંપૂર્ણ રીતે

વા નોટિસ બેંકને બાકી રકમ ચૂકવવા માટે હાથથી પહોંચાડાયેલ/રજિસ્ટર્ડ એડી પોસ્ટ દ્વારા

મોકલવામાં આવી હતી. ઋણ લેનારાઓ/ગેરંટરો રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, ઋણ

(સ્થાવર મિલકતોનું વર્ણન)

**	લનારા/આ/નુ નામ બાંયઘરી આપનાર/ઓ	સુરક્ષિત વર્ણન સંપત્તિ (સ્થાવર મિલકતો)	25%
1.	 ક્ષી અલય બિયલ સિંહ (ઉપાર લેનાર) અને ક્ષીમતી જ્યોતિ ઉપાશંકર સિંહ (ઉપાર લેનાર) 	તે બધી જ સ્થાવર મિલકતનો ટુકડો અને ભાગ જે બ્લોક નં. પ૧૩, પ્લોટ નં. ૪/આરએસ નં. ૩૫૩, દીપીએસ નં ૧૨, ફાઇનલ પ્લોટ નં. ૧૪૭, મહાદેવ નગર - ૧, ગોડાદરા ડિડોલી રોડ, ધોર્યાલી, સુરત, ગુજરાત ખાતે આવેલ છે.	60296200640 26.12.2023 થી રૂ. 1208650.23 નું લેજર ખેલેન્સ + રૂ. 101756.00 નું લાગ ન આવેલ લાજ - તેના પ્રક

તારીખ: 02/01/2025 ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી બેંક ઓફ મહારાષ્ટ્ર

AFLOAT ENTERPRISES LIMITED

(Formerly known as Adishakti Loha and Ispat Limited)

Regd. Office: Plot 3, SHOP 325, DDA C.CNTR, Aggarwal Plaza, Sec-14, Rohini New Delhi 110085

Phone: 011-27860681, E-mail: info@adishaktiloha.com, CIN: L51909DL2015PLC275150

CORRIGENOUM TO THE NOTICE OF THE EXTRAORDINARY GENERAL MEETING
An Extraordinary General Meeting "FGM" of the Members of Afleat Extraordinary General Meeting "FGM" of the Members of Afleat Extraordinary General Meeting "FGM" of the Members of Afleat Extraordinary GR, 2025 at 0:0:0
P.M., 35T) at 1th expectated of the Company of 1:0:0.5, 3:0:0:0:0
P.M., 35T) at 1th expectated of the Company of 1:0:0.5, 3:0:0:0:0
P.M., 35T) at 1th expectated of 1:0:0
P.M., 35T) at 1th expectated to 1:0:0
P.M., 35T) at 1th expectation of 1:0

Company on Jamusery 15, 2025 in due compliance with the previous of the Companies Act, 2013, and rules made thereunder, mad with circulars issued by Ministry of Corporate Affairs and Scientifies Exchange Board of India. Capitalized words and expressions used but not defined berein shall have the same meaning as assigned to them in the EGM. Notice.

This Corrigendum is being issued to give socion to amendi previde additional details as mentioned herein and pursuant to the previsions of SEEI Issued of Capital and Disclosure Requiements Regulations, 2018.

1. Paragraph 11 of fitten No. 1 in the Natice is modified to state the following:

"RESOLVED THAT pursuant to previsions of Sections 23,1186. 42, 62, 1181. and other applicable previsions, if any, of the Companies Act, 2013, the Companies Prospector and Allerment of Sections 23, 1186. 42, 62, 1181. and other applicable previsions, if any, of the Companies (Chare Capital and Debontures) Roles, 2014 and other applicable roles through the customer of the companies of the companies

By Order of the Board of Directors For AFLOAT ENTERPRISES LIMITED

PAWAN KUMAR MITTAL

Apollo

INDRAPRASTHA MEDICAL CORPORATION LIMITED

Registered office: Sarita Vihar, Delhi Mathura Road, New Delhi - 110076 Corporate Identity Number: L24232DL1988PLC030958 Phone: 91-11-26925858, 26925801, Fax: 91-11-26823629

E-mail: imclshares@apollohospitals.com, Website: delhi.apollohospitals.com

Extract of Statement of unaudited Financial Results for the Quarter and Nine-months ended 31st December, 2024

Year ended Quarter ended Nine-months ended 31.12.2024 30.09.2024 31.12.2023 31.12.2024 31.12.2023 31.03.2024 **Particulars** (Unaudited) Total income from operations (Net) 355.87 310.73 1038.91 1261.59 Net Profit / (Loss) for the period (before Tax, 40.67

Exceptional and/or Extraordinary items) 166.11 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 123.96 Net Profit / (Loss) for the period after tax 32.81 42.40 29.44 119,98 92.79 (after Exceptional and/or Extraordinary items) e Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) nd Other Comprehensive Income (after Tax)] Paid-up Equity share capital 91.67 91.67 91.67 (Face value Rs. 10/- each) 386.09 Reserves (excluding Revaluation Reserves) as shown in the audited balance sheet of previous year Earnings per share (of Rs. 10/- each) (for continuing 3.58 4.63 3.21 13.09 13.52 and discontinued operations) - Basic & Diluted

The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and nine-months ended 31st December, 2024, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results for the quarter and nine-months ended 31st December, 2024, are available on the Stock Exchange websites (www.bseindia.com and www.nseindia.com and on the company's website

Place : New Delhi

(Managing Director) DIN: 88570283

SHALBY LIMITED

Regd. Office: Shalby Multi-Specialty Hospitals, Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad 380015, Gujarat • Tel: 079 40203000 Fax: 079 40203109 E-mail: companysecretary@shalby.in website: www.shalby.org CIN: L85110GJ2004PLC044667

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2024

(₹ in million, except per share data)

	Particulars		Standalone		Consolidated		
Sr.		Quarte	er ended	Nine Months ended 31-12-2024	Quarter ended		Nine Months
No.		31-12-2024	31-12-2023		31-12-2024	31-12-2023	ended 31-12-2024
		(Una	udited)	(Unaudited)	(Una	udited)	(Unaudited)
1	Total income from operations	2,206.40	1,951.53	6,656.26	2,756.33	2,160.47	8,220.62
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	357.70	384.79	1,100.62	123.50	308.11	564.67
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	357.70	384.79	1100.62	123.50	308.11	564.67
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	208.58	247.24	688.35	(29.93)	190.64	141.08
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	209.16	247.88	690.08	(57.45)	190.65	111.33
6	Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- each) (Net of Treasury Shares)	1,074.87	1,073.53	1,074.87	1,074.87	1,073.53	1,074.87
7	Reserves (excluding Revaluation Reserve)	2		8.			
8	Earnings Per Share (Face Value of ₹ 10/- each) (not annualized)						
	(I) Basic EPS	1.94	2.30	6.41	(0.28)	1.78	1.31
	(II) Diluted EPS	1.94	2.30	6.41	(0.28)	1.78	1.31

1. The above is an extract of the detailed format of unaudited financial results for the guarter and Nine Months ended December 31, 2024,

filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone and Consolidated Financial Results for the quarter and Nine Months ended December 31, 2024 are available on the websites of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and on the Company's website www.shalby.org,

Place: Ahmedabad Date: February 3, 2025



For and on behalf of Board of Directors Dr. Vikram Shah Chairman and Managing Director DIN: 00011653